

July 26, 2026

To,
BSE Limited
Corporate Relationship Department
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Mumbai – 400001.

BSE Scrip Code: **515085**
ISIN: **INE298E01022**

Subject: Newspaper Advertisement of Standalone Unaudited Financial Results for the quarter ended June 30, 2026

Dear Sir/Madam,

Pursuant to Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith the copies of newspaper advertisement pertaining to Standalone Unaudited Financial Results of the Company for the quarter ended June 30, 2026, published by the Company on Sunday, July 26, 2026 in the Financial Express in English Language and Loksatta Jansatta in Gujarati Language.

The above information is also available on the website of the Company at www.restile.com

You are requested to take the above information on your records and oblige.

Thanking you,

Yours faithfully,
For Restile Ceramics Limited

Palak Jash


Palak Kumari
Company Secretary and Compliance Officer
Membership No. A69959

Encl: as above

RESTILE CERAMICS LIMITED

Regd. Office : 204, Sakar Complex, Opp. ABS Tower, Vaccine Crossing, Old Padra Road, Vadodara, Gujarat - 390015, India.
CIN : L26931GJ1986PLC102350

Branch Office : D.No.1-10-77, 5th Floor, Varun Towers, Opp. Hyderabad Public School, Begumpet, Hyderabad - 500 016.
E-mail : restile@accountscare.com, works@restile.com, Website : www.restile.com **Ph. No. 9998219763**

| Granamite | Mirrorstone | PearlRock | MarboGranit | Impacta | Gripmax

રાસાયણિક ક્ષેત્ર અર્થતંત્રનું ‘મૂળભૂત’ ક્ષેત્ર છે, જે ઘણા ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે

૩૦૩૦ કરોડની ‘ભવ્ય-રસાયણ’ યોજનાને મંજૂરી

આ યોજના સ્થાનિક અને વિદેશી રોકાણોને આકર્ષિત કરશે, ઉત્પાદન ક્ષમતામાં વધારો કરશે



નવી દિલ્હી, તા.૨૫

કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે ભારતને રસાયણો ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે ત્રણ મોટા કેમિકલ પાર્ક સ્થાપવા માટે રૂ. ૩,૦૩૦ કરોડની નવી યોજનાની જાહેરાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળે ભારત ઔદ્યોગિક વિકાસ યોજના (ભવ્ય-રસાયણ) ને મંજૂરી આપી. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ૨૦૨૬-૨૭ ના બજેટમાં જાહેર કરાયેલ આ યોજનાનો કુલ ખર્ચ ૩,૦૩૦ કરોડ છે. આમાંથી ૩,૦૦૦ કરોડ વહેંચાયેલ માળખાગત સુવિધાઓ અને મૂળભૂત સુવિધાઓના વિકાસ પર ખર્ચવામાં આવશે, જ્યારે ૩૦ કરોડ વહીવટી ખર્ચ માટે ફાળવવામાં આવશે. આ યોજના

ચોરસ કિલોમીટર (લગભગ ૨,૦૦૦ એકર) ખાલી જમીનની જરૂર પડશે. આ ઉદ્યાનો ગ્રીનફિલ્ડ (નવું) અથવા બ્રાઉનફિલ્ડ (જૂનું) હોઈ શકે છે, જેની પસંદગી રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવશે. વૈષ્ણવે જણાવ્યું હતું કે રાસાયણિક ક્ષેત્ર અર્થતંત્રનું “મૂળભૂત” ક્ષેત્ર છે, જે ઘણા ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે.એક સત્તાવાર નિવેદન અનુસાર, કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ સ્થાપિત દરેક પાર્ક માટે મહત્તમ ૧,૦૦૦ કરોડનું અનુદાન આપશે. જોકે, સંબંધિત રાજ્ય સરકારે ઓછામાં ઓછા૫૦૦ કરોડનું યોગદાન આપવું પડશે. સરકારે જણાવ્યું હતું કે આ યોજના રાસાયણિક ઉદ્યોગની સમગ્ર મૂલ્ય શ્રુ ખલાનો વિકાસ કરશે. સંસાધનોનો વધુ સારો ઉપયોગ સુનિશ્ચિત કરશે અને

ડ્રાઈવરને જાનથી મારી નાખવાની ધમકી આપી

લક્ઝરી બસ હંકારી બે આરોપીઓ ફરાર

ભરૂચ,તા.૨૫

વાગરા તાલુકાના દહંજ GIDC વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. ખાનગી કંપનીના કર્મચારીઓના પરિવહન માટે ઉપયોગમાં લેવાતી લક્ઝરી બસના ડ્રાઈવરને જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપી બે શખ્સો બસ હાઈજેક કરી ફરાર થઈ જતાં સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાએ GIDC વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યાં છે. ફરિયાદ મુજબ બસ ડ્રાઈવર રવિ બાબુભાઈ પટેલ બસ લેવા પહોંચ્યા ત્યારે લખીયામના ભાવેશ પ્રભુ આહિર અને દહેજના જયદેવસિંહ પરાકમસિંહ ગોહિલ ઈકો કારમાં ત્યાં આવ્યા હતા. ભાવેશે સીધો બસમાં બેસી બસ ચાલુ કરી દીધી હતી. ડ્રાઈવરે વિરોધ કરતાં બંનેએ અપશબ્દો બોલી ધમકી આપી હતી કે, “સાઈડમાં હટી જા, નહીં તો બસ ચડાવી દઈશું.” ત્યારબાદ ભાવેશ બસ લઈને નીકળી ગયો હતો, જ્યારે જયદેવસિંહે પણ ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ ડ્રાઈવરે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જોકે, ત્રણ દિવસ બાદ આરોપીઓ બસ દહેજ પોલીસ મથક નજીક છોડી ફરાર થઈ ગયા હોવા છતાં હજુ સુધી તેમની ધરપકડ નથી. આ બનાવને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જાહેરમાં ધાકધમકી આપી વાહન કબજે કરનાર આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાથી તેમની તાત્કાલિક ધરપકડ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

 બેંક ઓફ બરોડા મુંબઈ, તાલુકો-સાવલી, જિલ્લો-બરોડા-૩૬૧૭૭૫ (ગુજરાત) ફોન: ૦૨૬૬૭-૨૬૪૪૨૨, ઈમેલ:info@bankofbaroda.com	બેંક ઓફ બરોડા-સ્પેશીલાઈઝ્ડ એસએસઆઈ શાખા મુંબઈ, તાલુકો-સાવલી, જિલ્લો-બરોડા-૩૬૧૭૭૫ (ગુજરાત) ફોન: ૦૨૬૬૭-૨૬૪૪૨૨, ઈમેલ:info@bankofbaroda.com
--	---

પરિશિષ્ટ – IV – કલ્પ ૮ (૧) કલ્પના અંગેની નોટિસ (સ્થાયિન મિલકત માટે)

નીચે સહી કરનાર સીક્યુરીટાઈઝેશન એન્ડ રીફાઈન્સિંગ એન્ડ ફાસનાનીયલ એસેટ્સ એન્ડ એન્કોર્પોરેટેડ ઓફ સીક્યુરીટી ઈન્ફર્સ્ટ્રક્ચર, ૨૦૦૨ હેઠળ નોંધાયેલ ૧૩(૧૨) ના (નિયમ ૮) ની સાથે વાંચતા સીક્યુરીટી ઈન્ફર્સ્ટ્રક્ચર (એન્કોર્પોરેટેડ) રૂલ્સ ૨૦૦૨ મળેલા અધિકારો હેઠળ બેંક ઓફ બરોડા ના અધિકૃત અધિકારીની ફરિયાદો નીચે જણાવેલ બાકી કરજદાર-નેસર્સ એમ.જે.ટ્રેડિંગ, ભાગીદાર- શ્રી ભાવેશકુમાર સુર્વકાંત પટેલ, શ્રી વિજયેશ એમ પટેલ, અને જામીનદાર- શ્રી ભાવેશકુમાર સુર્વકાંત પટેલ, શ્રી બજેશ એમ પટેલ ને કીનામત નોટીસ તા.૧૬.૦૫.૨૦૨૬ ના નોટીસ પાઠવેલી બાકી ખાતેદાર સામે દર્શાવેલી રકમ રૂ. ૧,૯૬,૩૦,૦૮૯.૮૫ (રૂ. એક કરોડ છન્નુ લાખ ત્રીસ હજાર નેચ્વાંતી અને પૈસા પંચચાસી પુરા) તા. ૩૧.૦૩.૨૦૨૬ ના રોજ સાથે વધુ વ્યાજ અને ખર્ચ ઉપરોક્ત નોટિસની તારીખ/ઉક્ત નોટિસ મળ્યાની તારીખથી ૩૦ દિવસની અંદર પરત કરવા જણાવ્યું હતું.

બાકી કરજદાર/જામીનદાર/મોર્ટેગેજર નીચે જણાવેલી રકમોની પરત ચૂકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી, આ સાથે બાકી કરજદાર/જામીનદાર/મોર્ટેગેજર અને નાગરિકને જણાવવામાં આવે છે કે નીચે સહી કરનારે અને આવેલા નીચે દર્શાવેલી મિલકતનું ઉપર જણાવેલ નીયમોના સીક્યુરીટી ઈન્ફર્સ્ટ્રક્ચર રૂલ્સ ૮ ને સંબંધીત કલમ ૧૩(૪) ની સાથે વટકુમ્મ એક્ટ વાંચતા તેને/તેણીને પ્રાપ્ત થતી સત્તાઓ અનુસાર મિલકતનો સાંકેતિક કબજો તા. ૨૧.૦૭.૨૦૨૬ ના રોજ લીધો છે.

બાકી કરજદાર/જામીનદાર/મોર્ટેગેજર અને સામાન્ય સંદર્ભમાં નાગરિકોને અને નીચે જણાવેલી અનુસુચિત મિલકતની ભાવતામાં કોઈપણ પ્રકારનો વ્યવહાર કે લેવડ દેવડ ન કરવા ચેતવણી આપવામાં આવે છે, બેંક ઓફ બરોડા ની લેણા રકમ રૂ. ૧,૯૬,૩૦,૦૮૯.૮૫ (રૂ. એક કરોડ છન્નુ લાખ ત્રીસ હજાર નેચ્વાંતી અને પૈસા પંચચાસી પુરા) ૩૧.૦૩.૨૦૨૬ ના રોજ અને તેના પરનું વ્યાજ પ્લસ અન્ય ચાર્જ્સ

દેવાદારને ધ્યાન દોરવામાં આવે છે કે પોતાની મિલકત સેફરન ૧૩ ના એક્ટ હેઠળ સબ સેફરન (૮) મુજબ મિલકત મેળવવા રકમ ભરવા સમયની યોગવાઈ કરવામાં આવી છે.

તમામ ભાગ અને હિસ્સો સ્થવાર રહેણાંક મિલકત આવેલ તેનો રેવન્યુ સર્વે/બ્લોક નં. ૧૭૪૩, કુલ એરીયા ફોનફ્રન ૩૨૩૭ ચોરસ મીટર, શંભુ પાર્ક, પ્લોટ નં. ૦૬ સેક્ટરન ૧૨૦.૭૮ ચોરસ મીટર, મોજે સાવલી નો રજીસ્ટ્રેશન સબ જીલ્લો અને જીલ્લો વહોદરા જે શ્રી પટેલ ભાવેશભાઈ સુર્વકાંત ની છે અને ચતુર્સીમા: પૂર્વ: પ્લોટ નં. ૦૫, પશ્ચિમ: પ્લોટ નં. ૦૭, ઉત્તર: કોમન રોડ, દક્ષિણ: બ્લોક નં. ૧૭૪૪.

તમામ ભાગ અને હિસ્સો સ્થવાર રહેણાંક મિલકત આવેલ તેનો સીટી સર્વે નં. ૮, ટીકા નં. ૮ સેક્ટરન ૮૩૨.૪૧૩૮ ચોરસ મીટર, ‘હરિષ્પષ્ટા કોમ્પ્લેક્સ’ ત્રીજો માળ, ફ્લેટ નં. ૩૦૩, કુલ બિલ્ડઅપ એરીયા ફોનફ્રન ૭૭.૧૦ ચોરસ મીટર, મોજે-સાવલી નો રજીસ્ટ્રેશન સબ-જીલ્લો સાવલી અને જીલ્લો વહોદરા જે શ્રી પટેલ ભાવેશભાઈ સુર્વકાંત ની છે અને ચતુર્સીમા: પૂર્વ: ફ્લેટ નં. ૩૦૪, પશ્ચિમ: રસ્તો, ઉત્તર: રસ્તો, દક્ષિણ: ફ્લેટ નં. ૩૦૨.

તમામ ભાગ અને હિસ્સો સ્થવાર રહેણાંક મિલકત આવેલ તેનો સીટી સર્વે નં. ૮, ટીકા નં. ૮ સેક્ટરન ૮૩૨.૪૧૩૮ ચોરસ મીટર, ‘હરિષ્પષ્ટા કોમ્પ્લેક્સ’ ત્રીજો માળ, ફ્લેટ નં. ૩૦૫, કુલ બિલ્ડઅપ એરીયા ફોનફ્રન ૭૭.૮૬ ચોરસ મીટર, મોજે-સાવલી નો રજીસ્ટ્રેશન સબ-જીલ્લો સાવલી અને જીલ્લો વહોદરા જે શ્રી પટેલ ભાવેશભાઈ સુર્વકાંત ની છે અને ચતુર્સીમા: પૂર્વ: રસ્તો, પશ્ચિમ: ફ્લેટ નં. ૩૦૨, ઉત્તર: ફ્લેટ નં. ૩૦૪, દક્ષિણ: ફ્લેટ નં. ૩૦૬.

તમામ ભાગ અને હિસ્સો સ્થવાર રહેણાંક મિલકત આવેલ તેનો સીટી સર્વે નં. ૮, ટીકા નં. ૮ સેક્ટરન ૮૩૨.૪૧૩૮ ચોરસ મીટર, ‘હરિષ્પષ્ટા કોમ્પ્લેક્સ’ ત્રીજો માળ, ફ્લેટ નં. ૨૦૨, કુલ બિલ્ડઅપ એરીયા ફોનફ્રન ૬૫.૯૭ ચોરસ મીટર, મોજે-સાવલી નો રજીસ્ટ્રેશન સબ-જીલ્લો સાવલી અને જીલ્લો વહોદરા જે શ્રી પટેલ ભાવેશભાઈ સુર્વકાંત ની છે અને ચતુર્સીમા: પૂર્વ: ફ્લેટ નં. ૨૦૫, પશ્ચિમ: રસ્તો, ઉત્તર: ફ્લેટ નં. ૨૦૩, દક્ષિણ: ફ્લેટ નં. ૨૦૧.

તારીખ: ૨૧.૦૭.૨૦૨૬
સ્થળ: સાવલી

સહી /- અધિકૃત અધિકારી
બેંક ઓફ બરોડા

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ			
બ્લોક નં. ૧૧, બીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, સેક્ટર-૧૦, ગાંધીનગર. ફોન નં. ૦૭૯-૨૪૨૫૪૫૫૯ Email: mdgbcde14@gmail.com			
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના વ્યક્તિઓ માટે વ્યાજ સહાય યોજના.			
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગાંધીનગરની સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની જાતિના અરજદારોએ દેશ/વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે, સ્વરોજગાર/ધંધા માટે તેમજ પરીવાર અર્થે ખરીદેલ વાહન માટે, બેન્ક મારફતે લીધેલ લોન ઉપર વ્યાજ સહાય/સબસીડી આપવા નીચેની વિગતે યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે.			
ક્રમ	યોજનાનું નામ	વ્યાજ સહાય/સબસીડી	લાભાર્થી દીઠ મહત્તમ વાર્ષિક સહાય (વધુમાં વધુ ત્રણ વર્ષ માટે)
૧	ભારતમાં અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બેન્ક મારફતે લીધેલ લોન પર વ્યાજ સબસીડી	૬%	રૂ.૧.૫૦ લાખ
૨	સ્વરોજગાર માટે બેન્ક મારફતે લીધેલ લોન પર વ્યાજ સબસીડી	પુરૂષ લાભાર્થી ૬% અને મહિલા લાભાર્થી ૭%	પુરૂષ લાભાર્થી માટે રૂ.૬૦ હજાર અને મહિલા લાભાર્થી માટે રૂ.૭૦ હજાર
૩	પરીવાર માટે બેન્ક મારફતે લીધેલ લોન પર વ્યાજ સબસીડી	૬%	રૂ.૧.૨૦ લાખ

ઉક્ત યોજનાઓમાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની જાતિના અરજદારો પાસેથી તા.૨૭/૦૭/૨૦૨૬ થી લક્ષ્યાંક મુજબની અરજીઓ મળે ત્યા સુધી યોજનાલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ યોજનાઓનો લાભ લેવા માટે નિમગ્નના પોઇટ <https://gbcdeonline.gujarat.gov.in> પરથી ઓનલાઇન અરજી કરી તેની સાથે જણાવેલ આધાર પુરાવાઓ (PDF FORMAT)માં અપલોડ કરવામાં રહેશે. વધુ માહિતી માટે અને ઓનલાઇન અરજી કરવા જરૂર જણાય તો જે ને જીલ્લાના જીલ્લા નાયબ નિયામકશ્રી (વિ.જી.)/જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જી.)ની કચેરી/ જીલ્લા મેનેજરશ્રી, વિજાક સંલગ્ન નિમગ્નોની ગુપ્ત જીલ્લા કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. અથવા આ નિમગ્નોની વેબસાઇટ <https://sje.gujarat.gov.in/gbcde> પરથી યોજનાઓની પાત્રતા મેળવી લેવાની રહેશે અને અરજી કરતા પહેલાં યોજનાની વિગતો અવગચ વાંચી લેવા જણાવવામાં આવે છે.

યોજનાની પાત્રતાની શરતો / ધોરણો નીચે મુજબ રહેશે. :

(૧) અરજદારશ્રીએ નાણાંકીય વર્ષ:૨૦૨૫-૨૬ (એપ્રિલ કે તા. ૧/૪/૨૦૨૫થી) બેન્ક મારફતે લીધેલ લીધેલ હોવી જોઇએ. અંગૂઠાના વર્ષોમાં ઉક્ત યોજનાઓમાં બેન્ક મારફતે લીધેલ લોનના અરજદારો અરજી કરી શકશે નહીં.

(૨) લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોય તેવા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની જાતિના હોવા જોઇએ.

(૩) લાભાર્થી ધ્યાર બેન્કમાંથી મેળવેલ લોન અંગેનો પુરાવો વ્યાજ સહાય/સબસીડી મેળવવા માટે નિમગ્નને રજૂ કરવાનો રહેશે.

(૪) ભારતમાં અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસના હેતુ માટે બેન્ક મારફતે લીધેલ લોન પર રૂ. ૨૫.૦૦ લાખ સુધીની મર્યાદામાં મહત્તમ રૂ.૧.૫૦ લાખ સુધીની વ્યાજ સહાય ત્રણ વર્ષ માટે મળવાપાત્ર થશે.

(૫) સ્વરોજગાર માટે બેન્કમાંથી લીધેલ લોન પર રૂ.૧૦.૦૦ લાખ સુધીની મર્યાદામાં પુરૂષ લાભાર્થીને ૬% લેખે મહત્તમ વાર્ષિક રૂ.૬૦ હજાર તેમજ મહિલા લાભાર્થીને ૭% લેખે મહત્તમ વાર્ષિક રૂ.૭૦ હજાર વ્યાજ સહાય ત્રણ વર્ષ માટે મળવાપાત્ર થશે.

(૬) પરીવારન અર્થે રોજગાર માટે ખરીદ કરેલ વાહન માટે રૂ.૨૦.૦૦ લાખની મર્યાદામાં લીધેલ લોન પર લાભાર્થીને મહત્તમ વાર્ષિક રૂ.૧.૨૦ લાખની વ્યાજ સહાય ત્રણ વર્ષ માટે મળવા પાત્ર થશે.

(૭) ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીએ યોજના-૧૨માં પ૦૪૬ કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઇએ અને વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક રૂ.૧૦.૦૦ લાખ સુધીની હોવી જોઇએ.

(૮) સ્વરોજગારલક્ષી અને પરીવારન યોજના માટે લાભાર્થીની ઉંમર ૨૧ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇએ. અને લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક રૂ.૬.૦૦ લાખ સુધીની હોવી જોઇએ.

(૯) પરીવારન યોજના અંતર્ગત વ્યાજ સહાય મેળવનાર લાભાર્થી ધંધા રોજગાર માટે ખરીદેલ વાહન પાંચ વર્ષ સુધી વેચાલ કરી શકશે નહીં.

(૧૦) પરીવારન યોજના અંતર્ગત બેન્ક બરા મજૂર થયેલ લોન અન્વયે ખરીદેલ વાહનની આર.સી. બુકની પ્રમાણિત નકલ નિમગ્નને રજૂ કરવાની રહેશે.

(૧૧) પરીવારન યોજના અંતર્ગત વાહનનું રજીસ્ટ્રેશન આર.ટી.ઓ.માં Business Purpose (Taxi, Maxi, Transport) Vehicle તરીકે કરાવવાનું રહેશે.

(૧૨) ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ અમલીત શૈક્ષણિક અને સ્વરોજગાર યોજના અથવા વ્યાજ સહાય યોજના આ બન્ને પેકેટ ઓફ એક જ યોજનાનો લાભ અરજદાર મેળવી શકશે.

(૧૩) લોનમાં ફના થેટ વેઈ દરમિયાન મુદત અને વ્યાજની ભરેલ રકમની વિગત દર્શાવતા બેન્કના સાર્વજિક સિક્કાવાળા આધાર પુરાવા લાભાર્થી બરા રજૂ થયેથી વ્યાજ સહાય/સબસીડી સીધી જ લાભાર્થીના બચત ખાતામાં જમા મળવાપાત્ર થશે.

(૧૪) અરજીની તારીખે લાભાર્થીએ લીધેલ બેન્ક લોનનો નિયમિત ફાત્તા ભરવાનું ચાલુ રાખવું જોઇએ.

(૧૫) ઉક્ત યોજનાની વિગતો, સુચનાઓ અને શરતો અવગચ વાંચીને જ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.

(માહિતી/૯૫૫/૨૦૨૬-૨૭)			
મેનેજીંગ ડિરેક્ટર(વ.ચા.)		ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ	
ગાંધીનગર.			

બિઝનેસ આજકાલ

જૂનમાં સતત બીજા મહિને કેડિટ કાર્ડ ખર્ચ બે લાખ કરોડને પાર થયો

નવીદિલ્હી:જૂન મહિનામાં સતત બીજા મહિને કેડિટ કાર્ડ ખર્ચ ૨ ટ્રિલિયનનો આંકડો વટાવી ગયો, જેમાં HDFC બેંક અને SBI કાર્ડનો ફાળો સૌથી વધુ હતો, જ્યારે કેટલીક મોટી ખાનગી બેંકોમાં ખર્ચ મે મહિનાની સરખામણીમાં ઘટ્યો હતો, એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના તાજેતરના રીપોર્ટમાં જણાવાયું છે. જૂન મહિનામાં કુલ કેડિટ કાર્ડ ખર્ચ ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ૮.૮ લાખ વધીને ૨.૦૧ લાખ કરોડ થયો હતો. જોકે, મે મહિનામાં આ ખર્ચ ૨.૦૨ લાખ કરોડ હતો. દેશની સૌથી મોટી કેડિટ કાર્ડ જારી કરનાર HDFC બેંકે વાર્ષિક ચોરસે ૧૬.૨ ટકાનો વધારો નોંધાવ્યો હતો જે ૫૯,૪૮૨ કરોડ હતો.

ફ્લિપકાર્ટ બેંગલુરુથી ફૂડ ડિલિવરી સેવાઓ શરૂ કરશે

બેંગલુરુ: કંપની અન્ય શહેરોમાં વિસ્તરણ કરતા પહેલા ઓફરનું પરીક્ષણ કરવા માટે પ્રારંભિક લોન્ચનો ઉપયોગ કરે તેવી અપેક્ષા છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે ફ્લિપકાર્ટ એક અલગ એપ દ્વારા સેવા શરૂ કરવા પર વિચાર કરી રહી છે, જ્યારે તેને ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ પર પણ ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી રહી છે. વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ એક મહિનાની અંદર ભારતમાં તેની ફૂડ ડિલિવરી સેવા શરૂ કરવા માટે તૈયાર છે, જેની શરૂઆત બેંગલુરુમાં પાયલોટ રોલઆઉટથી થશે, કંપની અન્ય શહેરોમાં વિસ્તરણ કરતા પહેલા પ્રારંભિક લોન્ચનો ઉપયોગ ઓફરનું પરીક્ષણ કરવા માટે કરે તેવી અપેક્ષા છે.

ભારત-યુકે FTA: ૨૦૩૦ સુધીમાં નિકાસ \$૧૧૫ બિલિયન પહોંચશે

નવી દિલ્હી : ભારત અને યુકે વચ્ચેનો મુક્ત વેપાર કરાર, જે હમણાં જ અમલમાં આવ્યો છે, તે ભારતીય નિકાસ માટે એક મોટી તક રજૂ કરે છે. ઉદ્યોગ સંસ્થા એસોસિએટેસ એક અભ્યાસમાં આ મહત્વપૂર્ણ સમજ આપી છે. કરારના અમલમાં આવવાથી, ૨૦૩૦ સુધીમાં યુકેમાં ભારતની નિકાસ US\$ ૧૧૫ બિલિયન સુધી પહોંચી શકે છે. આ વર્ષે ૧૫ જુલાઈના રોજ સત્તાવાર રીતે અમલમાં મુકાયેલા આ ઐતિહાસિક કરારથી બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો મજબૂત થયા છે. એસોસિએટેસના અહેવાલ મુજબ કુલ વેપારનું પ્રમાણ પણ ઝડપથી વધશે, જે ૨૦૨૫-૨૬ માં અંદાજિત US\$ ૫૮ બિલિયનથી વધીને ૨૦૩૦ સુધીમાં US\$ ૧૧૫ બિલિયન થશે.

મારુતિએ નવી બ્રેગા અને લોન્ચ પર SUV વેચાણમાં વૃદ્ધિનું લક્ષ્ય રાખ્યું

મુંબઈ: મારુતિ સુઝુકી ઈન્ડિયા નાણાકીય વર્ષ ૨૦૨૭ માં સ્પોર્ટ યુટિલિટી વીકીલના વેચાણમાં વાર્ષિક ધોરણે ૨૫-૩૦ ટકાનો વધારો કરવાનું લક્ષ્ય રાખે છે, તાજેતરમાં લોન્ચ કરાયેલા મોડેલો અને તેના ખારખોડા પ્લાન્ટમાંથી વધારાના ઉત્પાદન પર આધારિત છે. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપનીએ નાણાકીય વર્ષ ૨૬ માં ૫૨૨,૦૦૦ થી વધુ જીક વેચી હતી. ૨૫-૩૦ ટકાનો વધારો તેના નાણાકીય વર્ષ ૨૭ માં જીક વોલ્યુમેને આશરે ૬૫૩,૦૦૦-૬૭૯,૦૦૦ યુનિટ સુધી લઈ જશે. “આ વર્ષે, જીક સેગમેન્ટમાં, અમારો વિકાસ ૨૫ થી ૩૦ ટકાની વચ્ચે રહેશે. અમે નોંધપાત્ર વૃદ્ધિનું લક્ષ્ય રાખી રહ્યા છીએ. પરંતુ વિક્ટોરિસ અને અમે બનાવેલા બ્રાન્ડ્સના સંયોજન પર આધારિત હશે.

ગ્રામીણ ભારતની આવક સ્થિર અને ખર્ચમાં વધારો : નાબાર્ડ સર્વે

નવી દિલ્હી, તા.૨૫

ગ્રામીણ ભારતમાં આવક વૃદ્ધિ નબળી પડી રહી છે, જેના કારણે પરિવારોનો તેમની બચત, રોજગાર અને ભવિષ્યની સંભાવનાઓ પરનો વિશ્વાસ ઘટી રહ્યો છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) દ્વારા જુલાઈ ૨૦૨૬માં દેશભરના ૨૦,૦૦૦ ગ્રામીણ પરિવારોના સર્વેક્ષણમાં, ૫૨.૬% લોકોએ ગયા વર્ષે આવકમાં કોઈ વધારો નોંધાવ્યો ન હતો, જ્યારે ૧૯.૮% લોકોએ ઘટાડો નોંધાવ્યો હતો. ફક્ત ૨૭.૭% લોકોએ આવકમાં વધારો નોંધાવ્યો હતો, જે સપ્ટેમ્બર ૨૦૨૪માં સર્વે શરૂ થયા પછીનો સૌથી ઓછો છે. આમ છતાં, ધરગથ્થુ ખર્ચમાં વધારો થયો છે, અને ગ્રામીણ ધરગથ્થુ વપરાશ ખર્ચમાં ખોરાકનો હિસ્સો સૌથી મોટો છે. ફક્ત ૩૯.૩% લોકો આગામી ત્રણ મહિનામાં રોજગારની સ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા રાખે છે.

દેશભરમાં સૌંદર્ય ઉદ્યોગસાહસિકો માટે કંપની ૩૦ વર્ષથી દેશમાં કાર્યરત

સ્વિડીશ બ્યૂટી અને હેલ્થકેર બ્રાન્ડ ઓરિફ્લેમ

ભારતમાં તેના ઉત્પાદન વ્યવસાયનું વેચાણ કરશે

અકુમ્સ ડ્રગ્સની પેટાકંપની પ્યોર એન્ડ ક્યોર સાથે કરાર પર હસ્તાક્ષર કરાયા

નવીદિલ્હી,તા.૨૫

સ્વિડિશ બ્યૂટી અને હેલ્થકેર બ્રાન્ડ ઓરિફ્લેમે ભારતમાં તેના ઉત્પાદન કાર્યોને પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડને ટ્રાન્સફર કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યાં છે, ઓરિફ્લેમે આજે જાહેરાત કરી. પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર એ ભારતની અગ્રણી કોન્ટ્રાક્ટ ડ્રગ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ (ઝકર્ફ) કંપનીઓમાંની એક, અકુમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. વ્યવહારની રકમ જાહેર કરવામાં



આવી નથી. પ્રસ્તાવિત સોદામાં રૂરકી, ઉત્તરાખંડ અને નોર્થીડા, ઉત્તર પ્રદેશમાં ઓરિફ્લેમ ઈન્ડિયાની ઉત્પાદન સુવિધાઓનો સમાવેશ થાય છે. આ વ્યવહાર પરંપરાગત બ